

**ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી**  
**સત્રાંત પરીક્ષા એપ્રિલ - 2011**

અભ્યાસક્રમ : સાર્ટિફિકેટ ઈન એન્વાયરમેન્ટ અવેરનેશ (CEA)  
નોંધણી નંબર : \_\_\_\_\_  
પાઠ્યક્રમ : પૃથ્વી તથા પૃથ્વીનું વાતાવરણ (CEA-01)  
તારીખ : 20/04/2011  
સમય : 11.00 to 12.30  
કુલ ગુણ : 35

---

પ્રશ્ન:-1 નીચેના પ્રશ્નોના જવાબ લખો. (05)

- (1) 'સ્કાય કેન્દ્રિય વિશ્વ'ની નવી માન્યતાઓ ને કોણે સાચી ઠેરવી ?
- (2) બ્રહ્માંડ શેનાથી બનેલું હોય છે.
- (3) પૃથ્વીની નજીકના હવાના વાતાવરણોને શું કહે શકું ?
- (4) ખગોળ વિજ્ઞાનના પિતા કોણ છે ?
- (5) દૂરભીનની શોધ કોણે કરી હતી ?

પ્રશ્ન:-2 પૃથ્વી ઉપર રચાયેલ પર્યાવરણની ચર્ચાનો. (10)

અથવા

વાયુચક વિશે સમજૂતી આપો.

પ્રશ્ન:-3 પર્યાવરણ શાસ્ત્રના રાસ્કરસનું મહત્વ સમજાવો. (10)

અથવા

ફોસ્ફરસ ચક અને સલ્ફર ચક વિશે સમજૂતી આપો.

પ્રશ્ન:-4 સૌર કંદળમાં અને અન્યત્ર બ્રહ્માંડમાં પૃથ્વી સિવાયના સજીવની શક્યતા તપાસો. (10)

અથવા

- (અ) પિરામિડો વિશે નોંધ લખો.
- (બ) નિવસનતંત્રનો જ્યાલ સમજાવી તેના લક્ષણો જણાવો.

**ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી**  
**સત્રાંત પરીક્ષા એપ્રિલ - 2011**

**અભ્યાસક્રમ** : સાર્ટિફિકેટ ઈન એન્વાયરમેન્ટ અવેરનેશ (CEA)  
**નોંધણી નંબર :** \_\_\_\_\_  
**પાઠ્યક્રમ** : પ્રદૂષણ અને પર्यાવરણના પ્રશ્નો તથા જાળવણી (CEA-02)  
**તારીખ** : 20/04/2011  
**સમય** : 03.00 to 04.30

કુલ ગુણ : 35

પ્રશ્ન:-1 (અ) નીચેના કાયદાઓને અમલ જે સાલથી શરૂ થયો તે મુજબ A અને B  
 સાથે જોડો. (06)

	A		B
1	કિટકનાશક દવાઓને લગતો કાયદો	1	1958
2	વન સંરક્ષણ અંગેનો કાયદો	2	1923
3	રાષ્ટ્રીય પર्यાવરણીય એપલેટ ઓથોરેટી એક્ટ	3	1962
4	પ્રાચીન સ્મારકો અને સ્થાપત્યો તેમજ તેના અંગેનો કાયદો	4	1968
5	પરમાણું ઊર્જા આધનિયમન	5	1980
6	ભારતીય બોયલર કાનૂન	6	1997

(બ) નીચેનાની વ્યાખ્યાઓ આપો. (04)

(1) પર્યાવરણ	(3) ઊર્જા
(2) શ્વસન	(4) પ્રકાશ સંશોધણ

પ્રશ્ન:-2 (અ) નીચેના સાધનોની ઉપયોગ શું છે ? જણાવો. (05)

(1) પ્રોટોમાટર	(4) મનોમીટર
(2) કિડેઝમીટર	(5) ગેલ્વેનોમીટર
(3) સિસમોમીટર	

(બ) ઊર્જા પિરામિડોની સમજૂતી આપો. (05)

પ્રશ્ન:-3 નીચેના ત્રણ પ્રશ્નોના જવાબ આપો. (15)

- (1) કુદરત સર્જિત પ્રદૂષણનું વર્ણન કરો.
- (2) ગ્રીનહાઉસ ઇફેક્ટ અથવા જ્લોબલ વોર્મિંગની સમજૂતી આપો.
- (3) ભારત સરકારે અને રાજ્ય સરકારે ઘડેલ પર્યાવરણ સંદર્ભના કાયદાઓ વિષે તમે જે જાણતા હો તે જણાવો.
- (4) ઓર્જોન સ્ટરનું ક્ષીણ થવું સમજાવો.